

UPSURGE SEEDS OF AGRICULTURE LIMITED

Plot No. 17, Shreenathji Industrial Estate, National Highway -27, KUVADVA -360 023. Dist. Rajkot (Gujarat) INDIA

E-mail: info@usalimited.in **Web.:** www.usaseedslimited.com **Cell:** +91 96879 66796 **CIN No.:** L01100GJ2017PLC099597

Ref. USASEEDS\NSE\NewspaperPubication

September 22, 2025

To,

The Manager- Listing Department,

National Stock Exchange of India Limited,
Exchange Plaza, Plot No. C/1, Block-G,
Bandra - Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Scrip Code: USASEEDS

Dear Sir/Madam,

Sub: Newspaper clippings - "Record date for issue of Bonus Equity Shares"

This is to inform you that an advertisement regarding the intimation of the Record Date for the Issue of Bonus Equity Shares has been published today, i.e., Monday, September 22, 2025, in the following newspapers:

Financial Express (English) and Financial Express (Gujarati).

The newspaper clippings are enclosed for your reference and records.

Please take the same on your record.

Thanking you,

For Upsurge Seeds of Agriculture Limited

Arvindkumar Jadavjibhai Kakadia Managing Director DIN: 06893183

Encl.: As above

INDUSIND BANK LIMITED

: 2401, Gen.Thimmayya Road (Cantonment), Pune-411 001 se Division: New No.34,G.N Chetty Road, T.Nagar, Chennai-6(sind Bank, 3rd Floor, Business Empire-5, 1/5 Jagnath Plot Co p BIC College, Paikot, 380001

Yagnik Road, Opp RKC College, Rajion-Ja6601

POSSESSION NOTICE

(Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2000

(Whereas the underspace being the Authorical Officer of Misses)

Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security interest in the United Security Security Conference on the Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Enforcement) Rules, 2002 (Interestable the and Reconstruction of Financial Assets) and Enforcement Rules, 2002 (Interestable the Security Interest Conference (Interestable Rules, 2002) (Interestable the Assets)

White Assets (Interestable Rules, 2002) (Interest ment) Rules 2002)

S. No	Name of Borrower /Guarantor, Loan Agreement No	Demand Notice Date	Outstanding Amount
	ALL CONTROL CO	Possession Date	
1.	Borrower: MR. CHAVDA DHARMESH	30.01,2025	Rs.6,16,962.83/-
	ARJANBHAN SIO ARJANBHAN Co-Borrower (s): MRS. SHIVANI PANCHABHAI KARAMATA WIO DHARMESH BHAI Guarantor: MR. CHAVADA JAYDIPs Agreement No: GRJ05297M Dated 29.11.2022	Possession Date 18.09.2025	(Rupees Six lakt sixteen thousand nine hundred and sixty two and eighty three paise Only) as on 30.01.2025

6 property area of dimensioning 48-98 Sq. Mts. (known as source), Ac. 3-05 Guthas of Veraval, located within the limits of Veraval Nagarphas Somnath. Bounded by: East by: Adj. Property of Sub Pict No. 508, Werl of Source of

Road	
Date: 18.09.2025	Sd/- (Authorized Officer)
Place: Veraval	For Industrid Bank Limited.



POSSESSION NOTICE

The undersigned being the authorized officer of the Central Bank of India, P [Br ask Ix Meels, under the Securitation and Reconstruction of Financial Assets Ix Meels, under the Securitation and Reconstruction of Financial Assets Infocurement of Security Interest Act 2002 (94 DF 2002) and in awardies of powers conflict on Security Interest Act 2012 (94 DF 2002) and in awardies of powers conflict activation of the Security Interest Activation (Security Interest Activation Assets Interest and Interest Assets Interest Inter

to borrower/quarantor and the public in general that the undersigned has seession of the property described herein below in exercise of powers for Sub-Section (4) of Section 13 of Act read with rule 8 6 9 of the forcement Rules 2002 on this 18th day September of the year 2025. The borrowers/jourantor in particular and the public in peneral is hereby

erty and any dealings with the property will be subject to the charge of the India, Pij Branch, Dist Kheda, for an amount Rs. 8,36,805.66 (Rs. Eight Thousand Eight Hundred Five and Paisa Sixty-Six Only) and intere

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

e Of Property In The Name Of Mrs. Nitaben Jaykishan Lokwani, Jaykishan Lokwani, Bearing Flat No. G/2, Tower-II, Kara tika-1 at Manijoura Ta-Nadiad, Dist, Kheda, Area 45 So Mtr

South : Flat No. G/3
 West : Common Pass

Union Bank of India, Navranggura-Ahmedabad First Boo, Mr. Navranggura-Post Office, Navranggura-Post Office, Navranggura-Post Office, Navranggura-Post Office, Navranggura-Post Office, Navranggura-Post Office, Navranggura-

POSSESSION NOTICE (Rule 8(1))

POSSESSION NOTICE (call 6/10)

Whereas The undersigned being the authorised officer of Union Bank of India, Navranggura Branch, 1st Floor, Near Navranggura Branch, 1st Floor, Near Navranggura Branch, 1st Floor, Near Navranggura Head Post Office, Navranggura Branch, 1st Floor, Near Navranggura Head Post Office, and Enforcement Security, Interest. Act, 2002 and in exercise of powers conferred unders Section 13/12; need with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 07.05.2025 calling upon the Bornover/Guarantor Ms. Lury I Pharma, Mr. Sanajy Bhallabhal Barot, Mr. Vinubhal Chimanbhal Nayl, Mr. Lalijbhal Valijbhal Patel, Mr. Sanabhal Patel, Mr. Vishmubhal R. Patel to tappy the amount motion of the notice being Kr. 24.4,3,904; Mr. Vinvort Rupeas severily lakhs Forum; and says from the date of receipt of the said notice.

The bornover hanging laided for payl whe amount, motion is netherly given to the bornover and the public in general that the undersigned has taken possessism of the property describe herein below in secretice of powers conferred on himber under Section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 19th day of September of the year 2023.

borrower and the public in gentres in less we service of powers conferred on him/he properly described herein below in services of powers conferred on him/he under Section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 19th day of September of the year 203. The borrower in particular and he public in general is hereby caudinoed not to der with he properly and yeakings with the properly will be subject to the charge off the Union Bank of India, Navrangoura Branch, Ahmedabad for the amounts of Rss. 744,390(i)—flowfors Severell Lauft Fourty Three Thousand Nine Hundro Only) as on 06-05-2023 and rules interest and expense thereox.

Suaranter's attention is invited to provisions of sub-section (8) of the said Act, in respect of time available to redeem the

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

ALL THAT PIECE & PARCEL of Properly bearing "Factory land and building situated at western side of Revenue Survey No.571 (old office No. 517) admissionable at western side of Revenue Survey No.571 (old office No. 517) admissionable and Registration Sub-District of Immunitaryagu withing District. Saberlantha and Registration Sub-District of Immunitaryagu Properly District Saberlantha and Registration Sub-District of Immunitaryagu Properly District. Saberlantha and Registration Sub-District of Immunitary No.572 (Sub-District Land of Survey No.573 & 559, East: Remaining Land of Survey No.553. & 559. East: Remaining Land of Survey No.553. Authorized Officers.

यूनियन बैंक Union Bank

POSSESSION NOTICE (Bible 1) (I) (II) (II) (III) (IIII) (III) POSSESSION NOTICE [Rule - 8 (1)] (For im

shift day of Sept 2025.

White day of Sept 2025.

Sept

DESCRIPTION OF IMMOVABLE PROPERTY:							
Sr. No.	Description	In the Name o					
1.	Shop No 1,2,3,4 on the Ground Floor in Shaswal (Ahmedabad) Association which is known as Shi Nivas Complex in in Dist. Ahmedabad, Talukal/City Mouje Ghodasan; Survey No. 288, TPS No 1 of Final Plot No 2 of Sub Plot No 28, Shop No.1 admeasuring 264 sq. ft., Shop No.2 admeasuring 344 sq. ft., Shop No.3 admeasuring 344 sq. ft., Shop No.3 admeasuring 344 sq. ft., Total admeasuring 1958 sq. ft., Total admeasuring 19	M/s. Shiv Prasad Enterprises. (Partnership Firm)					



POSSESSION NOTICE [Rule - 8 (1)] (For in

The undersigned being the Authorised Officer of Union I youlla Branch, 75/77, Sant Savta Marg, Byculla East, Munder the Securitisation and Reconstruction of Financial Assents Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exponential Control of the Control of Contro 400010 under the "Efforcement Security Interest Act, 2002 (peak with rule 3 of the Security responses confirmed under Section 13 (2) read with rule 3 of the Security responses confirmed under Section 13 (2) read with rule 3 of the Security responses (a) under the Security responses (b) under the

himsher under Section 13(4) of the said Act read with rule 8 of the said rules of the said rules of the Section 13(4) of the said Act read with rule 8 of the said rules of the Section 13(4) of the S

No.	Description	In the Name of
1.	Shop No. 1.2.3.4 on the Ground Floor in Shaswat (Ahmedabad, Ascotation which is known as Shin Nivas Complex in in Dist. Ahmedabad, Taluka/City Mouje Ghodasar, Survey No. 258, 179 No. 1 of Final Plot No. 2 of Sub Plot No. 28, Shop No.1 admeasuring 264 sq. ft., Shop No. 2 admeasuring 184 sq. ft. shop No. 3 admeasuring 346 sq. ft. and Shop No. 4 admeasuring 306 Sq. ft. Total admeasuring 1868 sq. ft. sci. 184 Sq. descending 1868 sq. ft. ft. ft. ft. ft. ft. ft. ft. ft. ft	M/s. Shiv Prasad Enterprises. (Partnership Firm)

Date: 19.09.2025 Place: Ahmedabad

यूनियन बैंक 🕼 Union Bank

POSSESSION NOTICE [Rule - 8 (1)] (For im

Visites The undersigned being the authorised officer of Union Bank of India, Bycula Branch, 7377, Sart Sarta Marg, Bycula Est, Murniar Germann, 1977, Sart Sarta Marg, Bycula Est, Murniar Bank, 1977, Sart Sarta Marg, Bycula Est, Murniar Bank, 1977, Sart Sarta Marg, Bycula Est, Murniar Beinders Marg, 1977, Sarta Marg,

In the purporty described in elevation of the control of the contr

Sr. No.	Description	In the Name of
1.	Shop No. 1,2,3,4 on the Ground Floor in Shaewat (Ahmedabat) Association which is known as Shri Nivas Complex in in Dist Ahmedabad, Takka/Cly Mouje Ghodasar, Survey No 258, TPS No 1 of Final Plot No 2 of Sub Plot No 28, Shop No.1 admeasuring 264 sq. ft., Shop No.2 admeasuring 264 sq. ft., Shop No.2 admeasuring 306 Sq. ft. Total admeasuring 1068 sq. ft. t. Total admeasuring 1068 sq. ft. Total admeasuring 1068 sq. ft. t. Total admeasuring 1068 sq. ft. t. Total admeasuring 1068 sq. ft. t. Total admeasuring 1068 sq.	M/s. Shiv Prasad Enterprises. (Partnership Firm)

INDUSIND BANK LIMITED

APPENDIX IV-A
[See provision to Rule 8(6) & 9(1)]
of Notice for Sale of Immovable P

& E.Auction for sale of Immovable Assets under the Securitization a ction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 re so to Rule 8(6) & 9(1) of the Security Interest (Enforcement) Rules. 20

ESIAct). Thereby given to the public in general and in particular to the Borrowerfs), Co-bo-nation (s) that the below described immoveable properties mortgaged to the St. In the physical possession of which has been dission on 270/80/22 bit on the Influsion Bank Limited. The sourced assets, will be sold as "As and where that is basis", "whether there is basis", "No recourse Basis" on 280/80/22 of Rs. 6.80/80%—as on 220/80/22 bit opinion with further interest cost & expense secured Cerdisors from following borrows: Co-borrower & Guarnetto exercise for the common to the

ank Ltd.

se successful bidder(s) shall pay and deposit 25% of the Sale Price (less 10%, amount alrea aid along with the Bidl) is. the purchaser needs to pay remaining 15% on sale confirmation delate of-e-Auction conclater than the mod forset working day. There after the balance 75% of the Sale Price is required to be deposited within 15 days from the date of Sonfirmation Letter as contemplated under a per SAPAFESEN.

tails of Borrowers, Co-1)Rupareliya Dharam K Son Of Kirar

Address	Guarantors	Junagadh, Gujarat -362001 Also At:- Flat No.5, 1st Floo Pankaj Appartment, Block No 13, Nava Nagarvada, Street N
		3, Junagadh, Gujarat - 362001.
		2)Ms.Rupareliya Tanvi Dharam S/D/W Mohanbhai (Co Borrower) Near R/o Nava Nagarvada, Street No 3, Nea Randal Kuva, Junagadh, Gujarat-362001.
oan Accou	nt Number	GRJ05001M

Hundred)
Rs.29,160/- (Rupees Twenty Nine Thousand One Hundred) Date & Time of E-auction Last date of submission of bio along with EMD

58 https://www.bankeauctions.com novable Alf he piece and parcel of land and building in the residential Flat No. The assuring 450-bg st, for 1st floor in building calle 'Panksi, 'Appartment' in are called Nagaruda, O'I Sarvey/NGOV Wall Not. 13, Chi, Survey No 259, Junagad 300001. Bounded as East: Other properly, West: Flat No.f North-Starr and Flat No. A. South-Fandali Nava

TERMS AND CONDITIONS:
E-auction is being held on "AS AND WHERE BASIS", "AS IS WHAT IS BASI
"WHATEVER THERE IS BASIS" basis and will be conducted "ONLINE".

"WHATEVER THÉRE IS BASIS" basis and will be conducted "POLINE".

The autors will be conducted rhough phisadis desire approved service provider Mis C I Inc.
Private Limited at the web portal trigos, view bannessections com

Both Countents, Declarations, Cereal Tierras and Conditions of certain auction sale as
provider in https://www.bankeauctions.com

To the bast of knowledge and information of not the Authorised Officer, there is no enumbran
on the properties. However, the intending bidders should make their own independent
jungsiere spranging the accommence, the deporties pot on auction and claims (right
advertisement does not constitute and will not be deemed to constitute any commitment
advertisement does not constitute and will not be deemed to constitute any commitment

An experience of the control of the

Authorized Officer Indusind Bank Ltd



UPSURGE SEEDS OF AGRICULTURE LIMITED

CIN: U01100GJ2017PLC099597

Reg. address: PLOT NO. 17, SHREENATHJI INDUSTRIAL ESTATE, NATIONAL HIGHWAY 8-B, KUVADVA

Website: www.usaseedslimited.com • Fmail: info@usalimited.in

NOTICE TO THE MEMBERS OF THE COMPANY INTIMATION OF RECORD DATE FOR ISSUE OF BONUS EQUITY SHARES

NOTICE is hereby given that the Company has fixed Friday, 26th September, 2025 as the "Record Date" to determine th shareholders for the purpose of allotment of 30,25,628 Bonus Equity Shares of Rs. 10/- (Rupees Ten Only) each in the i.e. 3 (Three) new fully paid-up bonus equity share of Rs. 10/- (Rupees Ten Only) each for every 7 (Seven) existing equity share of Rs. 10/- (Rupees En Only) each.

shares shall be allotted in dematerialised form only.

Any member(s) who becomes entitled to a fraction of a new equity share(s) to be allotted as borus share(s), the Company shall not issue any share or coupon or cash in respect of such fractional share(s), however, the total number of such here equity share(s) representing such fractional entitlement of all the members of the Company, shall be allotted by the Board to a nominee to be appointed by the Board, who shall not such fractional share(s) as trustee(s) for the equity sharefulders who shall have been entitled to such fractional share(s) in case the same were issued/allotted to them and such nomine(s) will sell such share(s) and state (s) as trustee(s) for the equity sharefulders who shall have been entitled to such fractional share(s) in case the same were issued/allotted to them and such nomine(s) will sell such share(s) and tested proceeds of such share(s) fractional share(s), after adjusting cost and expenses in respect thereof, be distributed among such member(s) who are entitled to such fractional share(s) in proportion of their respective holdings and/or their respective fractional entitlement thereof.

Date : 20th September, Place : Kuvadva, Rajko

For Upsurge Seeds of Agriculture Limited Arvindkumar Jadavjibhai Kakadia Managing Director

homefirst

Home First Finance Company India Limited CIN: L55990MH2010PLC240703 Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.co

POSSESSION NOTICE

REF: POSSESSION NOTICE UNDER SUB-RULE (1) OF RULE 8 OF THE SECURITY INTEREST (ENFORECEMENT) RULES. 2002

Sr. No	Name of Borrowers/ Co-Borrowers/ Guarantors	Description of Mortgaged Property	Date of Demand Notice	Total O/s as on date of Demand Notice (in INR)	Date of possession
1.	Sunilbhai Amrutlal Dangar, Asmitaben Sunilbhai Dangar,	Shop No-1/104, First Floor, Global Plaza, Rev sur no 190/paiki, Plot no 1, Off. Rajkot. Gondal N H 8/B Road, Att. Veraval (Shapar), Talt. Kotdasangani, Rajkot,Gujarat,380924 Bounded by North-Passage & Road, South-Shed no 111, East-Shop no 1/105, West-Shop no 1/103.	06-05-2025	6,36,505	17-09-2025
2.	Rajesh Kushwaha	House-64,Shiv residency,Shiv Residency, R.S No. 351/2, Block No:-420, After Re-Survey Block No. 470, Moje-Haldharu, Sub Dist: Kamrej, Dist:-Surat,Surat,Gujarat,3943 0. Bounded By-North: Pilot no. 63, South: Pilot no. 65, East: Pol No. 81, West: Society Internal road.	03-10-2024	11,58,565	18-09-2025

The borrower having failed to repay the amount, notice is hentrely given to the borrower (Guarantic and the public in general that the undersigned has taken Possession of the property discribed herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 30 fithe said rule on the date mentioned above. The BORROWERS (QUARANTORS and the Public IN OREMAL enter help voluding on to deal with the above referred provings-Socured Assets or any part thereof and any dealing with the said Properties Socured Assets and support the public in Centre of the Public IN OREMATION and the public in Centre of the Society of the Soci



MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED

DEMAND NOTICE

Under Section 13(2) of SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY ACT 2002 ("Act") read with Rule 3 of the Security interest (Enforcement) Rules, 2002 ("Rules").

Whereas the undersigned being the Authorized officer of the MAS Rural Housing & Mortgage Finance Ltd. (Hereinafter called Company') under the Act and in exercise of powers conferred under section 13(2) read with rule 3 of the Rules already issued the detailed demand notices dated as mentioned below. Under Section 13(2) of the Act, calling upon the Borrower(s)/Co-Borrower(

Mortgage Proporty Details:

Mortgage Proporty Details:

Mortgage Proporty Details:

Mortgage Proporty Details:

Mortgage Round Proporty Detail AJAYKUMAR ANILKUMAR MISHRA (APPLICANT)
ISARAVTIDEVI ANILKUMAR
MISHRA (CO-APPLICANT)

PASSAGE THEN FLAT NO. G/2

With further interest, additional interest at the rate as more particularly stated in respective Demand Notice, incidental expenses, cost, charges etc incurred till the date of payment and/or realization. If the said Borrower(s)(D-o-Borrower(s)(D-usrantor(s) shall fail to make payment to Company as aforesaid. Then Company shall proceed against the above Secured Asset(s)(Immovable Property(sie) under Section 13(4) of the said Act and the applicable Fulse entirely at the risk of the said Borrower(s)(D-usrantor(s) as to the costs and consequences. The said Borrower(s)(D-Borrower(s)(D-usrantor(s) as to the costs and consequences. The said Borrower(s)(S-usrantor(s)) are prohibited under the said Act to Transfer the aforesaid Secured Asset(s)(Immovable Property(ies), whether by way of said, lease or otherwise without prior written consent Of Company. Any contrastention of the said section by you shall invoke the penal provisions as laid down under section 29 of the SARFAESIAct and/or any other legal provision in this regard.

Authorized Offices

Authorized Officer, For, MAS Rural Housing & Mortgage Finance Ltd. Mr. Bharat J. Bhatt (M.) 9714199018

Whereas the undersigned being the authorized officer of the MAS Rural Housing & Mortgage Finance Ltd. under the Security Interest (Enforcement Rules 2002)
Whereas the undersigned being the authorized officer of the MAS Rural Housing & Mortgage Finance Ltd. under the Security Interest (Enforcement Rules 2002)
Whereas the undersigned being the authorized officer of the MAS Rural Housing & Mortgage Finance Ltd. under the Security Interest (Enforcement of Security Interest Act - 2002 (Set) and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of security Interest (Enforcement) Rules 2002 (Set) sead ademand notice dated as on below details calling upon the Borrowerf-Co-borrower/Fourarintor to repsy the amount mentioned in the notice being within Sixty Days from the date of receipt of the said notice.

The Borrower having failed to pray the amount, notice is hereby given to the Borrowerf-Co-borrower/Guarantor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said (Act read with Rule 3 for the Security Interest (Enforcement) Rules 2002, as no below details.

The Borrower/Co-borrower/Guarantor in particular and the public in general is hereby caucitored not to deal with the property and any dealings with the Property with the subject to the charge of the MAS Rural Housing & Mortgage Finance Ltd. as on below details and interest thereon.

The Borrower/Co-borrower/Guarantor attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Borrower & Co-Borrower, Guarantor Name	Description Of The Immovable Property	Loan A/C No Date of Possesion	Date & Amount of Demand Notice
1	DIPAK PREMCHAND MAURYA (APPLICANT) LAXMI DIPAK MAURYA (CO-APPLICANT)	PROPERTY SEARING ALL THAT PIECE AND PARCEL OF SAID RLOT NO.469 ADMESSAIRING 40 15 50 MTRS. AL ONG WITH LINDIVIDED SHARE IN ROAD & COP ADMESSAIRING 18 48 50. MTRS. TOTAL ADMESSAIRING 18 40 50. MTRS. TOTAL ADMESSAIRING 18 50. MTRS. & TOGETHER WITH CONSTRUCTION THERE ON IT HE SCHEME KNOWN AS "SHREE NEELKANTH RESIDENCY" STUATED AT REVENUE SURVEY NO 1081, 1079, 109, 116 OF BLOCK NO. 999 ADMESSAIRING 31161 SOLMTES, ATVILLAGE SYADALA TO, LOPAD, INTHE REGISTRATION DISTRICT & SUB DISTRICT OF SURVEY STATE ADJOINING PLOT NO.469 NORTH ROAD SOLMTES, ATT ADJOINING PLOT NO.459 NORTH ROAD SOLMTES, ATTOMESSAIR SOLMTES, ATTOMESSAIR AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH ROAD SOLMED SAIS ADJOINING PLOT NO.469 NORTH ROAD SOLMED SAIS ADJOINING PLOT NO.469 NORTH AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH AS PER DOLUMENTS SAIS ADJOINING PLOT NO.459 WEST T. ADJOINING PLOT NO.469 NORTH AS PROMED TO NORTH AS PROMED TO NO.469 NORTH AS PROMED TO NORTH TO NORTH AS PROMED TO NO.469 NORTH AS PROMED TO NORTH TO NO.469 NORTH AS PROMED TO NORTH TO N	Loan Account No : 8948 16-09-2025	Rs. 8,80,841.00 in Words Eight Lakhs Eighty Thousand Eight Hundred Forty One Rupees Only as on Date 23.05.2025
2	PRAVINKUMAR MOHANBHAI PATEL (APPLICANT) REKHABEH PRAVINKUMAR PATEL (CO-APPLICANT) JAYANTILAL RATANASIBHAI PATEL (GUARANTOR)	PROPERTY BEARING ALL THAT PIECE AND PARCEL OF SAID LAND BEARING RAJUR GROUP GRAM PANCHAYAT PROPERTY NO.43 & 44 ADMESSURING 26.8 18 S. M. MTRS. BLA GROUND FLOOR ADMESSURING 158.5 IS O, MTRS. CAPE FLOOR ADMESSURING 74.3 SO, MTRS. CAPE 169.07 S. MTRS. ALDRUG WITH CONSTRUCTION THE SAID STATE OF THE SAID STATE OF DANASURA IN THE REGISTRATION DISTRICT RAVALL, GULARAT. BOUNDED AS FOLLOWS: AS PER TECHNICAL EAST: ROAD WEST: ROAD NORTH: ROAD SOUTH: HOUSE OF PARTEL JAYANDISHA ISANDASBHAI SOUNDED AS FOLLOWS: AS PER SALE DEED EAST: ROAD WEST: ROAD WEST: ROAD WEST ROAD SOUTH: R	Loan Account No : 5676 17-09-2025	Rs. 11,35,955.00 in Words Eleven Lakhs Thirty Five Thousand kine Hundred Fifty Five Rupees Only as or Date 26.02.2025

Date : 22-09-2025 Place : Surat

epaper.financialexpress.com

-

uthorized Officer, Mr. Bharat J. Bhatt (M.) 9714199018 For, MAS Rural Housing & Mortgage Finance Ltd. Ahmedabad

sus shares shall be allotted to the members of the Company whose names appeared in the Register of Members / Regist eneficial Owners maintained by the Depositories, as on Friday, 26th September, 2025, the "Record Date" fixed for th

purpose.

The Bonus Equity Shares, once allotted, shall rank pari-passu in all respect with the fully paid-up equity shares of the Company at existing on the Record Date and shall always be subject to the terms and conditions contained in the Memorandum and Articles on Association of the Company.

Pursuant to Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018, new Bonus shares shall be allotted in dematerialised form only.



Home First Finance Company India Limited

Website: homefirstindia.com
Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com

કબજા નોટીસ

સંદર્ભ : સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ ના પેટા – નિયમ (૧) હેઠળ કબજા નોટીસ

જણાવવાનું કે હોમ કરર્ટ કાયનાન્સ કંપની ઇન્ડિયા લીમીટેડના નીચે સહી કરનાર અધિકત અધિકારીએ સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટક્શન ઓક કાયનાન્સિયલ એસેટર અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો એક્ટ નં. ૫૪) હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી કલમ ૧૩ (૨) હેઠળ નીચે જણાવેલ તારીખોએ માંગણા નોટીસ જારી કરી, નીચે જણાવેલ તમો/દેવાદારોને સંબંધિત નોટીસ મળ્યાની તારીખથી **૬૦ દિવસ**ની અંદર બાકી રકમ ચુકવવા જણાવ્યું હતું. આમ છતાં, તમો/દેવાદારો આપેલ સમયગાળા દરમિયાન બાકી રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી **હોમ ફરર્ટ ફાયનાન્સ કંપની ઈન્ડયા લીમીટેડ** સરકૈસી એક્ટ, .ooર ની પેટા કલમ ૧૩(૪) સાથે વંચાતા તેના નિયમોની જોગવાઇઓ હેઠળ પ્રાપ્ત સત્તા અને હકોનો ઉપયોગ કરીને, અહીં નીચે જણાવેલ સિક્ચોર્ડ મિલકતોનો **કળજો** લઇ લીધો છે.

ક્રમ નં.	galeio /	ગીરો મિલકતની વિગત	માંગણા નોટીસની તારીખ	માંગણા નોટીસની તારીખ મુજબ બાકી રકમ (રૂા.)	કબજાની તારીખ
1.	સુનિલભાઈ અમૃતલાલ ડાંગર ,અસ્મિતાબેન સુનિલભાઈ ડાંગર	શોપ નં. ૧/૧૦૪, પહેલો માળ, ગ્લોબલ પ્લાઝા, રેવન્થુ સર્વે નં. ૧૯૦/પૈકી, પ્લોટ નં. ૧, રાજકોટ- ગોંડલ નેશનલ હાઈવે ૮/બી રોડ, મોજે વેરાવળ(શાપર), તાલુકો કોટડાસંગાણી, રાજકોટ, ગુજરાત, ૩૬૦૦૨૪. ચતુઃસીમાઃ ઉત્તરઃ પેસેજ અને રોડ, દક્ષિણઃ શેડ નં. ૧/૧, પુર્વઃ શોપ નં. ૧/૧૦૫, પશ્ચિમઃ શોપ નં. ૧/૧૦૩.		,,,,,,,	17-09-2025
2.	રાજેશ કુશવાહા	હાઉસ-દ્દર, શીવ રેસીડન્સી, રેવન્થુ સર્વે નં. ૩૫૧/૨, બ્લોક નં. ૪૨૦, રી સર્વે પછી બ્લોક નં. ૪૫૦, મોજે હલદારુ, પેટા જિદ્યો કામરેજ, જિદ્યો સુરત, ગુજરતા-૩૯૪૩૧૦. ચતુઃસીમાઃ ઉત્તરઃ પ્લોટ નં. દ્દ્ર, દક્ષિણઃ પ્લોટ નં. દ્દ્રપ, પૂર્વઃ પ્લોટ નં. ૮૧, પશ્ચિમઃ સોસાચટીનો અંદરનો સેડ	03-10-2024	11,58,565	18-09-2025

દેવાદારો રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/ જામીનદાર અને જાહેર જનતાને આથી જાણ કરવામાં આવે છે કે નીરો સહી કરનારે જણાવેલ નિયમોના નિયમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તે/તેણીને પ્રાપ્ત સતાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ મિલકતનો કબજો ઉપર જણાવેલ તારીખોએ લઇ લીધેલ છે. દેવાદારો/જામીનદારો અને જાહેર જનતાને આથી ઉપર જણાવેલ મિલકતો અથવા તેના કોઇ ભાગ સાથે સોદો ન કરવા સાવદા કરવામાં આવે છે અને જણાવેલ મિલકતો/સિક્ચોર્ડ એસેટો સાથેનો કોઇપણ સોદો હોમ ફર્સ્ટ કંપની ઇન્ડિયા લીમીટેડની ઉપરની મિલકતો/ સિકચોર્ડ એસેટો સામે જણાવેલ રકમને આધિન રહેશે જે પુરેપુરી ચુકવણી સુધી તેના પરના ચડત વ્યાગ

સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમચના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થળ : ગુજરાત તારીખ : ૨૨.૦૯.૨૦૨૫

અદ્યિકૃત અદ્યિકારી, હોમ ફર્સ્ટ ફાયનાન્સ કંપની ઇન્ડિયા લીમીટેડ



MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED

Narayan Chambers, 2nd Floor, B/h. Patang Hotel, Ashram Road, Ahmedabad-380009. Contact: 079-41106500/733

ડિમાન્ડ નોટીસ

સલામતીની કલમ ૧૩(૨) હેઠળ અને નાણાંકીય એસેટ્સની પુનનિર્માણ અને સુરક્ષાની સલામતી એક્ટ ૨૦૦૨(અધિનિયમ) સલામતી હિત (એન્ફોર્સમેન્ટ) રેલ્સ ૨૦૦૨ - નિયમોના નિયમ ૩ સાથે વાંચવા

આથી, માસ રૂરલ હાઉસીંગ એન્ડ મોર્ગેજ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા નીચે સહી કરનાર અધિકૃત અધિકારી 'એક્ટની કલમ ૧૩ (૨)ની સાથે અધિનિયમોના અધિનિયમ ૩ ન ાંચાણે લેતાં તેમને મેળેલા પાવરનો ઉપયોગ કરતાં એક્ટની કલમ ૧૩ (૨) હેઠળ અરજદાર(રો) સહ અરજદાર(રો) જામીન(નો) (તેમામને વ્યક્તિગત રીતે અથવા એક સાથે પ્રબંધનકર્તાઓ') કાયદેસરના વારસદાર(રો) કાયદેસરના પ્રતિનિધિ(ઓ) કે જેઓનાં નામ અત્રે નીચે જણાવેલ યાદીમાં આપવોમાં ઓવેલ છે,ને આથી નીચે પાઠવવામાં આવેલ માંગણાં નોટિસ(સી)માં જણાવવામાં આવેલ અંતર્ગત દિન ૬૦માં નીચે દર્શાવવામાં આવેલી વિગતો અનુસાર ભરપાઈ કરી જવા માંગણી નોટિસ જેતે તારીખ નીચે દર્શાવેલ મુજબ એક્ટની કલમ ૧૩ (૨) હેઠળ જારી કરવામાં આવેલ છે. સદર નોટિસોની નકલો રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી પાઠવવામાં આવેલ છે અને તે નીચે સહી કરનાર પાસે પણ મળી શકશે, અને સદર બંધનકર્તા(ઓ) કાયદેસરના વારસદાર(રો) કાયદેસરના પ્રતિનિધિ(ઓ), જો તેઓ ઇચ્છે તો સદર નકલ નીચે સહી કરનાર પાસેથી સામાન્ય કચેરીના કામના કલાક દરમિયાન મેળવી શકશે. ઉપરોક્તના અનુસંધાનમાં, ઓથી ફરી વખત નોટિસ ઓપર્વામાં આવે છે, કે બંધનકર્તા(ઓ) કાયદેસરના વારસદાર(રો) કાયદેસરના પ્રતિનિધિ(ઓ)એ સદર નોટિસ(સો) પાઠવ્યાના દિન ૬૦માં નીચે દર્શાવેલ સદરહુ નામો ધારણ કરનારાઓએ, તમામે એકસાથે નીચે કોલમમાં દર્શાવેલી વિગતો અનુસાર સંબંધિત તારીખે વધારાના વ્યાજ સાથે ચુકવણીની તારીખે અને/ અથવા વસુલાત, ધિરાણ કરોર અને અન્ય દસ્તાવેજો, લખાણો સાથે વંચાણે લેતાં, જો કોઈ, સદર બંધનકર્તા(ઓ) દ્વારા અમલ બજવણી કરવામાં આવેલ હોઈ એહી અત્રે નીચે દર્શાવવામાં આવેલી રકમ ભરપાઈ કરી જવી. ધિરાણની વસુલાતનાં બાકી લેણાં સામે MRHMFLને સદર બંધનકર્તા(ઓ)એ તારણ સંબંધે નીચે દર્શાવેલ સિકયોર્ડ એસેટ(સ) મુકેલ છે.

(અરજદાર) જેલવા, ખાતે સ્થિત બ્લોક નં. ૮૮/બી (એકીકરણ પછી બ્લોક નં. ૮૮ પૈકી, ૧૦૧, ઇસરાવતીદેવી અનિલકુમાર મિશ્રા (સલ-અરજદાર) પ્લોટ નં. ૨૩૯, ૨૪૦, ૨૪૧, ૨૪૨, ૨૪૩ (કેજેપી પછી બ્લોક નં. ૮૮/બી/૨૪૨ અને૮૮/બી/૨૪૩૯, ૮૮/બી/૨૪૦, ૮૮/બી/૨૪૧, ૮૮/બી/૨૪૨ અને૮૮/બી/૨૪૩) જમીન કે જે "સાંઈદીપ રેસીડેન્સી"ના નામથી ઓળખાય છે. તેના ક્ષેત્રફળ ૫૨,૧૭૨ ચો. મી. (બિલ્ટ અપ એરિયા) સીઢી, પેસેજ, પાર્કીંગ, ટેરેસ અને બીજા હક સાથે ઉપરાંત વણવહેંચાયેલ જીમીન હિસ્સા ક્ષેત્રફળ ૧૦.૦૦ ચો. મી. "ઓમ પેલેસ" તરીકે ઓળખાતી યોજનામાં તમામ સરળ અધિકારો છે તેના ફ્લેટ નં. જી/૩, ગ્રાઉન્ડ ફ્લોર ક્ષેત્રફળ ૬૬.૭૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરિયા)	અરહદાર અનુ સહ-અરહદાર હ્યમીવદારવા વામ	મિલ્કતનું વર્ણન	લોન એકાઉન્ટ નંબર લેણી રકમ	डिमान्ड नोटीस तारीफ स्टीडींग नोटीस तारीफ
(અરજદાર) ઇસરાવતીદેવી અનિલકુમાર મિશ્રા (સહ-અરજદાર) જોલવા, ખાતે સ્થિત બ્લોક નં. ૮૮/બી (એકીકરણ પછી બ્લોક નં. ૮૮ પૈકી, ૧૦૧, ૧૦૨) પ્લોટ નં. ૨૩૯, ૨૪૦, ૨૪૧, ૨૪૨, ૨૪૩ (કેજેપી પછી બ્લોક નં. ૮૮/બી/૨૪૨ અને૮૮/બી/૨૪૦, ૮૮/બી/૨૪૧, ૮૮/બી/૨૪૨ અને૮૮/બી/૨૪૩) જમીન કે જે "સાંઈદીપ રેસીડેન્સી"ના નામથી ઓળખાય છે. તેના ક્ષેત્રફળ ૫૨,૧૭૨ ચો. મી. (બિલ્ટ અપ એરિયા) સીઢી, પેસેજ, પાર્કીંગ, ટેરેસ અને બીજા હક સાથે ઉપરાંત વણવહેંચાયેલ જીમીન હિસ્સા ક્ષેત્રફળ ૧૦.૦૦ ચો. મી. "ઓમ પેલેસ" તરીકે ઓળખાતી યોજનામાં તમામ સરળ અધિકારો છે તેના ફ્લેટ નં. જી/૩, ગ્રાઉન્ડ ફ્લોર ક્ષેત્રફળ ૬૬.૭૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરિયા)	અજચકુમાર અનિલકુમાર મિશ્રા	જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અને સબ-ડિસ્ટ્રીકટ સુરત ખાતે આવેલ મોજે ગામ	बोन એકाઉन्ट नं. :	તા. ૦૫-૦७-૨૦૨૫
(સહ-અરજદાર) ૮૮/બી/૨૩૯, ૮૮/બી/૨૪૦, ૮૮/બી/૨૪૧, ૮૮/બી/૨૪૨ અને૮૮/બી/૨૪૩) જમીન કે જે "સાંઈદીપ રેસીડેન્સી"ના નામથી ઓળખાય છે. તેના ક્ષેત્રફળ ૫૨,૧૭૨ ચો. મી. (બિલ્ટ અપ એરિયા) સીઢી, પેસેજ, પાર્કીંગ, ટેરેસ અને બીજા હક સાથે ઉપરાંત વણવહેંચાયેલ જીમીન હિસ્સા ક્ષેત્રફળ ૧૦.૦૦ ચો. મી. "ઓમ પેલેસ" તરીકે ઓળખાતી યોજનામાં તમામ સરળ અધિકારો છે તેના ફ્લેટ નં. જી/૩, ગ્રાઉન્ડ ફ્લોર ક્ષેત્રફળ ૬૬.૭૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરિયા)	(અરહાર)			
(સહ-અરજદાર) \[\angle \zeta \cdot \cdot \cdot \left[\frac{1}{2\sigma \chi \cdot \chi \left[\frac{1}{2\sigma \chi \chi \left[\frac{1}{2\sigma \chi \chi \chi \chi \chi \chi \chi \chi	ઈસરાવતીદેવી અનિલક્રમાર મિશ્રા		રૂા. ૯,૩૫,૦૧૨.૦૦	તા. ૧७-૦૯-૨૦૨૫
તેના ક્ષેત્રફળ પ૨,૧૭૨ ચો. મી. (બિલ્ટ અપ એરિયા) સીઢી, પેસેજ, પાર્કીંગ, ટેરેસ અને બીજા હક સાથે ઉપરાંત વણવહેંચાયેલ જીમીન હિસ્સા ક્ષેત્રફળ ૧૦.૦૦ ચો. મી. ''ઓમ પેલેસ'' તરીકે ઓળખાતી યોજનામાં તમામ સરળ અધિકારો છે તેના ફ્લેટ નં. જી/૩, ગ્રાઉન્ડ ફ્લોર ક્ષેત્રફળ ૬ ૬.૭૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરિયા)	. •			
અને બીજા હક સાથે ઉપરાંત વણવહેંચાયેલ જીમીન હિસ્સા ક્ષેત્રફળ ૧૦.૦૦ ચો. મી. ''ઓમ પેલેસ'' તરીકે ઓળખાતી યોજનામાં તમામ સરળ અધિકારો છે તેના ફ્લેટ નં. જી/૩, ગ્રાઉન્ડ ફ્લોર ક્ષેત્રફળ ૬ ૬.૭૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરિયા)	,	અને૮૮/બી/૨૪૩) જમીન કે જે ''સાંઈદીપ રેસીડેન્સી''ના નામથી ઓળખાય છે.		
મી. ''ઓમ પેલેસ'' તરીકે ઓળખાતી યોજનામાં તમામ સરળ અધિકારો છે તેના ફ્લેટ નં. જી/૩, ગ્રાઉન્ડ ફ્લોર ક્ષેત્રફળ ૬ ૬.૭૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરિયા)				
ફ્લેટ નં. જી/૩, ગ્રાઉન્ડ ફ્લોર ક્ષેત્રફળ ૬ ૬.૭૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરિયા)		અને બીજા હક સાથે ઉપરાંત વણવહેંચાયેલ જીમીન હિસ્સા ક્ષેત્રફળ ૧૦.૦૦ ચો.		
		મી. ''ઓમ પેલેસ'' તરીકે ઓળખાતી યોજનામાં તમામ સરળ અધિકારો છે તેના		
		ફ્લેટ નં. જી/૩, ગ્રાઉન્ડ ફ્લોર ક્ષેત્રફળ ૬ ૬.૭૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરિયા)		
થિત્રફળ ૪૦.૦૫ ચો.મી. છે તેવી બાંધકામ સહિતની તમામ મિલકત. નીચે પ્રમાણે		ક્ષેત્રફળ ૪૦.૦૫ ચો.મી. છે તેવી બાંધકામ સહિતની તમામ મિલકત. નીચે પ્રમાણે		
ચતુર્સીમા ઃ ટેક્નિક્લ મુજબઃ પૂર્વ ઃ ખુલ્લી જગ્યા, પશ્ચિમ ઃ રોડ, ઉત્તરઃ સંલગ્ન		ચતુર્સીમા : ટેક્નિક્લ મુજબઃ પૂર્વ : ખુલ્લી જગ્યા, પશ્ચિમ : રોડ, ઉત્તરઃ સંલગ્ન		
બિલ્ડીંગ, દક્ષિણ: પેસેજ. નીચે પ્રમાણે ચતુર્સીમાઃ વેચાણ ડીડ મુજબ : પૂર્વ : લાગુ				
પેલેસ, પશ્ચિમ : રોડ, ઉત્તરઃ લાગુ બિલ્ડીંગ, દક્ષિણઃ પેસેજ પછી ફ્લેટ નં. જી/૨.		પેલેસ, પશ્ચિમ : રોડ, ઉત્તરઃ લાગુ બિલ્ડીંગ, દક્ષિણઃ પેસેજ પછી ફ્લેટ નં. જી/૨.		

વધારાના વ્યાજ સાથે, વધુ ચોક્કસ રીતે સંબંધિત માંગણાં નોટિસમાં દર્શાવવામાં આવેલ આકસ્મિક ખર્ચા, ખર્ચ, અન્ય ચાર્જીસ વગેરે, ચુકવણીની તારીખ સધી કરવામાં આવેલા ખર્ચા અને / અથવા પ્રતીત થયાઁ અનુસાર દૂરવર્તી વ્યાજની ચુકવણીની તારીખ અને છે અથવા વસુલાતની તારીખ સુધી પૂરેપૂરા ભરપાઈ કરવાના રહેશે. જો સેંદર બંધનકર્તા(ઓ) MRHMFLને ઉપરોક્ત દર્શાવવામાં આવેલે નાણાંની ચુકવણી કરવામાં નિષ્ફળ જશે તો, સિકયુરિટી એસેટ(સ) સ્થાવર મિલકત(તો) સામે સદર એક્ટની કલમ ૧૩ (૪) હેઠળે અને <u>લાગુ કરવામાં આવેલ નિયમો અનુસાર સંપૂર્ણ તથા સદર બંધનકર્તા(ઓ) કાયદેસરના વારસદાર(રો) કાયદેસરના પ્રતિનિધિ(ઓ) કાર્યવાહી કરશે જેના પરિણામો એને પડતર માટે</u> તેઓ જવાબદાર રહેશે

સદર બંધનકર્તા(ઓ)/કાયદેસરના વારસદાર(રો)કાયદેસરના પ્રતિનિધિ(ઓ) સદર એક્ટ હેઠળ ઉપરોક્ત તારણ પર મૂકેલી મિલકત(તો)સ્થાવર મિલકત(તો) વેચાણ, પદ્યા પર અથવા અન્ય કોઈ રીતે લેખિત અગાઉથી લીધેલી પરવાનગી વિના હસ્તાંતર કરી શકશે નહીં.

અધિકૃત અધિકારી તારીખ : ૨૨-૦૯-૨૦૨૫ વતી, માસ રૂરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ, શ્રી ભરત જે. ભટ્ટ (મો.) ૯७૧૪૧૯૯૦૧૮ સ્થળ : સુરત



MAS FINANCIAL SERVICES LIMITED

6th Ground Floor, Narayan Chambers, B/h. Patang Hotel, Ashram Road, Ahmedabad-380009. Contact: 079-41106500

ડિમાન્ડ નોટીસ

સલામતીની કલમ ૧૩(૨) હેઠળ અને સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ નિયમોના નિયમ ૩ સાથે વાંચવા

આથી નીચે સહી કરનાર માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ (એમએફએસએલ)ના અધિકૃત અધિકારીની રૂએ નીચેના દેવાદાર(રો)/ સહ દેવાદાર(રો)/ગીરવેદાર(રો)ને નોટીસ આપે છે જેઓ તેમની જવાબદારીઓ નિભાવામાં નિષ્ફળ ગયા છે એટલે કે માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ પાસેથી મેળવલ લોન જેઓએ લોન(નો) માટે તેમની મુદ્દલ તેમજ તેના પર લદાયેલ વ્યાજ અને અન્ય ચાર્જની પરત ચુકવણી કરવામાં કસુર કર્યો છે. પરિણામે તા. ૧૦-૦૭-૨૦૨૫ ૨૭-૦૩-૨૦૨૪ અને ૦૫-૧૧-૨૦૨૨ના રોજ લોન(ઓ) નોન પરફોર્મિંગ એસેટ્સ (N.P.A's) બની ગઈ છે. સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩ (૨) સરકેસી એકટ હેઠળ મળતી સત્તાનો ઉપયોગ કરીને તેમના છેલ્લા જાણીતા સરનામાં પર દેવાદારો/સહ-દેવાદારો/ગીરવેદારોને માંગણા નોટીસો જારી કરીને તેમના દ્વારા લેવાયેલ લોન સવલતો હેઠળની તેમની બાકી રકમની પતાવટ કરવા માટે તેમને જણાવ્યું હતું. આમ છતાં, તે બજવણી વગર પરત ફરી હતી/પ્રાપ્ત થઇ ન હતી. આથી, દેવાદાર(રો)/સહ-દેવાદાર(રો) / ગીરવેદારોને આથી આ નોટીસના માર્ગે લોનની સવલત હેઠળની બાકી રકમ તેમજ કરારના દરે તેના પરના ચડત વ્યાજ અને આકસ્મિક ખર્ચ, કોસ્ટ, ચાર્જ વગેરેની પતાવટ કરવા જાણ/માહીતગાર કરવામાં આવે છે.

અરહદાર અનુ સહ-અરહદાર યમાવદારના વામ		મિલ્કતનું વર્ણન	લોન એકાઉન્ટ નંબર લેણી રકમ	ડિમાન્ડ નોટીસ તારીખ સ્ટીકીંગ નોટીસ તારીખ		
 મેસર્સ શ્રી બાલાજી ઓટોમોબાઈલ્સ (પ્રોપરાઈટર શ્રી દેનીશ રાજેશકુમાર 	જત જિલ્લો સુરત ખાતે અ સીટી), જિલ્લો સુરત ખાતે	તે આવેલ રેવન્યુ સવ	લોન એકાઉન્ટ નં. : ૫૮૪૧७૨૯	તા. ૩૧-૦७-૨૦૨૫		
ખાડાવાલા હારા) (અરજદાર)	નવો સર્વે નં. ૧૦૯, ટી.પી				३ ।.४३,००,७३ ९.० ०	તા.૧૫-૦૯-૨૦૨૫
ર. શ્રી દેનીશ રાજેશકુમાર ખાડાવાલા	નં. : ૧૩, ફાઈનલ પ્લોટ					
(સહ-અરજદાર અને જામીનદાર)	બિલ્ડીંગ કે જે ''ઓમકાર					
3. સુશ્રી ઝરણા દેનીશ ખાડાવાલા (સહ-અરજદાર અને જામીનદાર)	ં અને ૨૩ (સાઈટ મુજબ દુ ક્ષેત્રફળ આશરે બિલ્ટ અ	પ એરીયા ૨૭.૪૪ [ા]				
,	ચોરસ મીટર કુલ બિલ્ટ					
	પ૦૮.૦૫ ચોરસ ફ્રુટ ઉ					
	હિસ્સા ક્ષેત્રફળ ૧૫.૦૫					
	ત્યારબાદ જે જગ્યાઓ અ					
	તમામ મિલકત. મિલક ત					
	પૂર્વ : ખુલ્લી જગ્યા, પશ્ચિ					
	દક્ષિણ : ખુલ્લી જગ્યા. ફ્					
	લેફ્ટ, પશ્ચિમ ઃ દુકાન નં. ૧૨૪, ઉત્તર ઃ પેસેજ, દક્ષિણ ઃ ખુલ્લી જગ્યા					
ચુનિવર્સલ ટ્રેડર્સ (ભાગીદાર શ્રી ભાવિનભાઈ મહેન્દ્રભાઈ શાહ દ્વારા)	જંગમ મિલકતનું વર્ણન સિક્ચોરિટી અને માર્જિનનું સમયપત્રક				લોન એકાઉન્ટ નં. : 3૨૯૮૫૦૦	તા.૧૦-૦૯-૨૦૨૫
(અરહદાર)	ગીરો કરારના અમલકર્તાનું નામ:— મેસર્સ. ચુનિવર્સલ ટ્રેડર્સ, તેના ભાગીદાર ભાવિનભાઇ મહેન્દ્રભાઇ શાહ હારા ભાગીદારી પેઢી				રૂા.૫૧,૦૯,૧૩૩.૦૦	તા.૧૫-૦૯-૨૦૨૫
શ્રી ભાવિનભાઈ મહેન્દ્રભાઈ શાહ (સહ-અરજદાર અને જામીનદાર)	(એ) સિક્ચોરિટીઃ-(રૂ. ૧,: સ્થિર સંપત્તિ					
श्री आनंह सुरेन्द्र शाह	પ્રોડક્ટનું નામ	કંપનીનું નામ	SPIIPO	नं ग		
(સહ-અરજદાર અને જામીનદાર)	હાઇડલબર્ગ સ્પીડમાસ્ટર ૪ ક્લર	३५ प्रिन्ट	વર્લ્ડપેક ઓટોમેશન	1.00		
શ્રીમતી શીતલ બી. શાહ	ઓફ્સેટ પ્રિન્ટિંગ		સિસ્ટમ			
(સહ-અરજદાર અને જામીનદાર)	मशीन ५३ X ७४					
શ્રીમતી શોભના અનુપચંદ શેઠ						
(सह-अरुष्टार अने क्षमीनहार)	ઉપકરણો સાથે					
૧. મેસર્સ ખેડુત એગ્રો કેમિકલ્સ		ગીરવેદાર/વહીવટકર્તાનું નામ : શ્રી જીગ્નેશભાઈ નારણભાઈ મોરી ગીરો મુકેલ મિલકતનું વર્ણન : જત જિલ્લો ગીર સોમનાથ ખાતે આવેલ				તા.૧૩-૦૮-૨૦૨૫
(પ્રોપરાઈટર શ્રી જીગ્નેશભાઈ નારણભાઈ મોરી હારા) (અરજદાર)	મોજે અને તાલુકો કોડીના	ટ, જિલ્લોઃ ગીર સોમ	४५०२५०० इा.२३,४८, <i>६</i> ४७.००	તા.૧७-૦૯-૨૦૨૫		
ર. શ્રી જીગ્નેશભાઈ નારણભાઈ મોરી (સહ-અરજદાર અને જામીનદાર)	નં. ૩૩૨૧/એ પૈકી, તેના પર આવેલ દુકાન નં. ૩ અને ૪ કે જેનું ક્ષેત્રફળ એરીયા ૧૮૫.૬૧,૦૦ ચો.ફુટ, ગ્રાઉન્ડ ફલોર, હર ગંગે કોમ્પ્લેક્ષ, ડો. જીવરાજ મહેતા રોડ, યુનિયન બેંક સામે આવેલ છે. તેવી તમામ મિલકત.					
3. સુશ્રી મંજુબેન નારણભાઈ મોરી	ુ જીવરાજ મહતા રાડ, યુા• ચતુર્સીમા નીચે મુજબ :	ાત્રા પક સામ આવ				
(સહ-અરજદાર અને જામીનદાર)	ઉત્તરઃદુકાન નં. ૦૨					
(=	દક્ષિણ : અન્ય મિલકત					
	પૂર્વ : પ્રવેશ અને કોમન પેર	સેજ				

ઉપરોક્ત દેવાદારો અને / અથવા સહ-દેવાદારો/ જામીનદારોને બાકી રકમ તેમજ ચડત વ્યાજ, આકસ્મિક ખર્ચ, કોસ્ટ વગેરે આ નોટીસના પ્રકાશનની તારીખથી ૬૦ દિવસની અંદર પરત ચુકવવા માટે સલાહ આપવામાં આવે છે. જેમાં નિષ્ફલ જતાં (માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડને પ્રાપ્ત અન્ય કોઇ પણ હક અથવા ઉપાય પ્રત્યે પુર્વગ્રહ વગર) સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૪) ની જોગવાઇઓ મુજબ સિક્યોર્ડ એસેટ/ગીરો મિલકતોને ટાંચમાં લેવાના અન્ય પગલા લેવામાં આવશે.

પશ્ચિમ : અન્ય મિલકત

ઉપર જણાવેલ વ્યક્તિઓને ઉપર જણાવેલ મિલકતો જેના પર માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ ચાર્જ ધરાવે છે તેની ફેરબદલી, વેચાણ, ભાડે અથવા ત્રાહીત

વ્યક્તિનું હિતન સર્જવા સલાહ આપવામાં આવે છે.

તારીખ : ૨૨-૦૯-૨૦૨૫

અધિકૃત અધિકારી વતી, માસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ

Revised Retail Sale Price (MRP) Declaration (In compliance with Rule 33 of the Legal Metrology

(Packaged Commodities) Rules, 2011)

Due to a change in the applicable Goods and Services Tax (GST) rate, warovski India Private Limited hereby notifies the public that the retail sale price (MRP) of the following pre-packaged commodities packed/imported before the GST revision stands revised with effect from 22/9/2025.

- Product Name & Original MRP (inclusive of all taxes) : SKU 5351296 ₹ 16900
- Product Name & Revised MRP (inclusive of all taxes) : SKU 5351296 ₹ 15800 Product Name & Original MRP (inclusive of all taxes) : SKU 5379518 ₹ 12900
- Product Name & Revised MRP (inclusive of all taxes) : SKU 5379518 ₹ 12000 The revised MRP reflects only the change in GST as permitted by the Ministry o

Consumer Affairs, Department of Legal Metrology, Government of India, Notification dated 09 September 2025.

The original MRP remains legibly displayed on every pack. Revised prices are being marked by stamping/sticker/online printing on the

This revision is valid until 31 December 2025 or until stocks are exhausted, whichever

For any clarification, please contact Swarovski India Private Limited Corp Office: UG Floor, Tower A, DLF Building 10, DLF Cybercity DLF Phase III, Sector - 24, Gurgaon-122002 Email: customer_service_in@swarovski.com

केनरा बैंक Canara Bank 🕸

ઉઝા શાખા મો. ૯७૯૯૦ કકર૦૫

પ્લેજ સોનાના ઝવેરાત / દાગીના / સિક્કાના જાહેર હરાજી માટે નોટીસ

નીચે દર્શાવેલ વ્યક્તિને આથી જાણ કરવામાં આવે છે કે તેઓ લોન ખાતાઓમાં જવાબદારીઓ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે. રજીસ્ટર્ડ પોસ્ટ હ્રારા તેમને મોકલવામાં આવેલ છે. આથી તેમને જવાબદારી અને અન્ય શૂલ્ક ચૂકવવા અને **તા. ૦૨/૧૦/૨૦૨૫** ના રોજ અથવા તે પહેલાં ગીરવે મૂકેલી સિક્ચોરીટીઝને રિડીમ કરવા વિનંતી કરવામાં આવે છે, જે નિષ્ફળ જાય તે બેંક દ્વારા જાહેર હરાજીમાં (ઓનલાઈન) બેંકના પરિસરમાં ખાતે ઉધાર લેનાર ખર્ચે ઉક્ત સિક્ચોરિટીઝ **તા.** 03/૧૦/૨૦૨૫ ના રોજ વેચાણ કરવામાં આવશે.

लोननी तारीज	લોન એકાઉન્ટ	કરજદારનું	ગીરો મૂકેલા સોનાના	કુલ વજન
	નંબર	નામ અને સરનામું	દાગીનાનું વર્ણન	આમમાં
28.02.2024	180277 871334	શ્રીમતી પાસીબેન ઈશ્વરલાલ પટેલ	બેંગલ્સ - ૧	29.50

કુલ બાકી લેણાં - રૂ. ૧,૩૩,૨૯૫.૬૩/- + ખર્ચ અને ભાવિ વ્યાજ

હરાજીની તારીખઃ ૦૩/૧૦/૨૦૨૫ **હરાજીનો સમય :** બપોરે ૦૧ થી ૦૩

હરાજીની જગ્યાઃ Online-https://egold.auctiontiger.net/

અનામત કિંમતઃ २,५४,०००/-તારીખઃ ૨૨-૦૯-૨૦૨૫

મેનેજર, કેનરા બેંક



સ્થળ : કુવાડવા, રાજકોટ

અપસર્જ સીક્સ ઓફ એગ્રીકલ્ચર લિમિટેક

CIN:- U01100GJ2017PLC099597 ૨જીસ્ટર્ડ ઓફિસઃ શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પ્લોટ નં. ૧७, નેશનલ હાઈવે ૮-બી, કુવાડવા જીઆઈડીસી પાસે,

કુવાડવા, રાજકોટ, ગુજરાત : ૩૬૦૦૨૩. Web: www.usaseedslimited.com, E-Mail:Info@usalimited.in

કંપનીના સભ્યોને સૂચના બોનસ ઇક્વિટી શેર જારી કરવા માટેની રેકોર્ડ તારીખની સૂચના

Phone: +91 1244698210

આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીએ 30,25,628 બોનસ ઇક્વિટી શેર 3:7 ના ગુણોત્તરમાં રૂ. 10/- (દસ રૂપિયા માત્ર) એટલે કે રૂ. 10/- (દસ રૂપિયા માત્ર) ના પ્રત્યેક 7 (સાત) હાલના સંપૂર્ણ ચૂકવેલા ઇક્વિટી શેર માટે રૂ. 10/- (દસ રૂપિયા માત્ર) ના 3 (ત્રણ) નવા સંપૂર્ણપણે ચૂકવેલા બોનસ ઇક્વિટી શેર ફાળવવા માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે શક્રવાર, 26 સપ્ટેમ્બર, 2025 ના રોજ ''રેકોર્ડ તારીખ'' નક્કી કરી છે,

કંપનીના તે સભ્યોને બોનસ શેર ફાળવવામાં આવશે જેમના નામ ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવતા સભ્યોના રજિસ્ટર / લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં શુક્રવાર, 26 સપ્ટેમ્બર, 2025 ના રોજ, આ હેતુ માટે નક્કી કરાયેલ 'રેકોર્ડ તારીખ' મુજબ દેખાયા હશે,

બોનસ ઇક્વિટી શેર, એકવાર ફાળવવામાં આવ્યા પછી, રેકોર્ડ ડેટ પર અસ્તિત્વમાં રહેલા કંપનીના સંપૂર્ણ ચૂકવેલ ઇક્વિટી શેર સાથે બધી રીતે પેરિ-પાસુ રેન્ક ધરાવશે અને હંમેશા કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં સમાવિષ્ટ નિયમો અને શરતોને આધીન રહેશે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (મૂડી અને ડિસ્ક્લોઝર આવશ્યકતાઓનો મુદ્દો) નિયમનો, 2018 અનુસાર, નવા બોનસ શેર ફક્ત ડિમટીરિયલાઈઝડ સ્વરૂપમાં જ ફાળવવામાં આવશે.

કોઈપણ સભ્ય જે બોનસ શેર(શેર) તરીકે ફાળવવામાં આવનારા નવા ઇક્વિટી શેર(શેર)ના અંશ માટે હકદાર બને છે, કંપની આવા અપુર્ણાંક શેર(શેર)ના સંદર્ભમાં કોઈ શેર, કૂપન અથવા રોકડ જારી કરશે નહીં, જોકે, કંપનીના તમામ સભ્યોના આવા અપૂર્ણાંક હકનું પ્રતિનિધિત્વ કરતા આવા નવા ઇક્વિટી શેર(શેર)ની કુલ સંખ્યા બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા એક નોમિનીને ફાળવવામાં આવશે, જે ઇક્વિટી શેરધારકો માટે ટ્રસ્ટી(શેર) તરીકે આવા અપુર્ણાંક શેર(શેર) ધરાવશે, જેઓ આવા અપૂર્ણાંક શેર(શેર) માટે હકદાર હશે જો તે તેમને જારી/ફાળવવામાં આવ્યા હોય અને આવા નોમિની(શેર) કંપની દ્વારા ફાળવવામાં આવેલા આવા અપૂર્ણાંક શેર(શેર)ને શક્ય તેટલી વહેલી તકે પ્રવર્તમાન બજાર દર(શેર) પર વેચશે અને આવા શેર(શેર)/અપૂર્ણાંક શેર(શેર)ની ચોખ્ખી વેચાણ આવ[ં]ક, તેના સંદર્ભમાં ખર્ચ અને ખર્ચને સમાયોજિત કર્યા પછી, આવા સભ્યો(શેર)માં તેમના સંબંધિત હોલ્ડિંગ અને/અથવા તેમના સંબંધિત અપૂર્ણાંક હકના પ્રમાણમાં વહેંચવામાં આવશે. અપસર્જ સીડ્સ ઓફ એગ્રીકલ્ચર લિમિટેડ માટે, તારીખઃ20/09/2025

Sd/-

(શ્રી અરવિંદકુમાર કાકડિયા) (મૅનેજિંગ ડિરેક્ટર) (DIN : 05/639/3)

(This is an Advertisement for information purpose only and not for publication or distribution or release directly or indirectly outside India and is not an offer docume or announcement.)



GSM FOILS LIMITED

Our Company was originally formed as Limited Liability Partnership Firm under the name and style of "M/s, GSM Foils LLP" pursuant to a Certificate of incorporation issued by Registrar of Companies, Central Registration Centre, dated April 05, 2019 with LLP registration number being AAO-7932. M/s. GSM Foils LLP was thereafter converted into a Private Limited Company "GSM Foils Private Limited" pursuant to the provisions of Chapter XXI of the Companies Act, 2013 and a fresh certificate of incorporation dated June 27, 2023 issued by Registrar of Companies, Central Registration Centre. Subsequently, our Company has been converted into a public limited company and the name of our Company changed to 'GSM Foils Limited" pursuant to a special resolution passed at the Extra-Ordinary General Meeting of our Company held on July 14, 2023 and a fresh Certificate of incorporation dated eptember 04, 2023 issued by the Registrar of Companies, Mumbai. The Corporate Identity Number of our Company is L43303MH2023PLC405459.

Registered Office: Gala NO 06/106/206/306, Sapphire Building, Diamond Industrial Estate, Vasai East IE, Thane, Vasai, Maharashtra, India, 401208;; Telephone: +9184689 68102; E-mail: investors@gsmfoils.com;

Website: www.gsmfoils.com; Contact Person: Pratik Mukeshbhai Makwana, Company Secretary and Compliance Officer

PROMOTERS OF OUR COMPANY: SAGAR GIRISH BHANUSHALI AND MOHANSINGH LAXMANSINGH PARMAR

FOR PRIVATE CIRCULATION TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF GSM FOILS LIMITED ("COMPANY" OR "ISSUER") ONLY

WE HEREBY CONFIRM THAT NONE OF OUR PROMOTERS OR DIRECTORS IS A

WILFUL DEFAULTER AS ON DATE OF THIS LETTER OF OFFER ISSUE OF 12.81.165* FULLY PAID-UP FOUITY SHARES OF FACE VALUE OF₹10 FACH OF OUR COMPANY (THE "**RIGHTS FOUITY SHARES**") FOR CASH AT A PRICE OF

₹180.00 PER RIGHTS EQUITY SHARE (INCLUDING A PREMIUM OF ₹170.00 PER RIGHTS EQUITY SHARE) ("ISSUE PRICE") AGGREGATING TO ₹ 2306.10 LAKHS" ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 1 (ONE) RIGHTS EQUITY ŚHARE FOR EVERY 10 (TEN) FULLY PAID-UF EQUITY SHARES HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON THURSDAY, AUGUST 28, 2025 ("RECORD DATE") (THE "ISSUE"). FOR FURTHER DETAILS, SEE "ISSUE INFORMATION" BEGINNING ON PAGE 67 OF THE LETTER OF OFFER.

*Assuming full subscription in the Issue. Subject to finalisation of Basis of Allotment

BASIS OF ALLOTMENT

The Board of Directors of our Company would like to thank all its shareholders and investors for their response to the Issue, which opened for subscription on Tuesday, September 09 2025 and closed on Thursday, September 18, 2025 and the last date for On-Market Renunciation of Rights Entitlements was Monday, September 15, 2025.

In the Right Issue, we received a total of 581Applications for 16,31,300 Rights Equity Shares through the application supported by blocked amount mechanism ("ASBA"). Out of which 153 Applications for 39,300 Rights Equity Shares were rejected due to technical reasons as disclosed in the Letter of Offer on page 75 and 76. The total number of valic Applications received were 428 for 15,92,000 Rights Equity Shares which was 1.24 times of the Issue Size. In accordance with the Letter of Offer, the Basis of Allotment was finalized on September 19, 2025, by our Company in consultation with National Stock Exchange of India Limited ('NSE'), the Designated Stock Exchange and the Registrar to the Issue ('RTA') The Board of Directors of our Company has on September 19, 2025 approved the allotment of 12,81,100 Right Equity Shares to the successful Applicants. All valid Applications after technical rejections have been considered for allotment. In the Issue, no Rights Equity Shares have been kept in abeyance. This is an SME Rights issue and the allotment need to be

done in multiple of lot size of 100 equity shares, due to that we have allotted 65 equity shares less to the issue size The breakup of valid applications received through ASBA (after technical rejections) is given below.

Category No. of valid applications received		No. of Rights Equity Shares accepted and allotted against Entitlements (A)	No. of Rights Equity Shares accepted and allotted against Additional Rights Equity Shares applied (B)	Total no. of Rights Equity Shares accepted and allotted (A+B)	
Eligible Equity Shareholders	406	2,44,700	10,30,900	12,75,600	
Renouncees*	22	5500	0	5500	
Total	428	2,50,200	10,30,900	12,81,100	

*The (identified based on DP ID and Client ID) whose names did not appear on the list of Eligible Equity Shareholders as on the Record Date, who held the Rights Entitlements ("RE") as on the Issue Closing Date and have applied for the Issue are considered as Renounces.

2. Information regarding total Applications received:

ı	Category	Applicat	ion Received	Rights Equity shares applied for			Rights Equity Shares allotted		
ı		Number	%	Number	Value (₹)	%	Number	Value (₹)	%
ı	Eligible Equity Shareholders	559	96.21	15,37,900	27,68,22,00	94.27	12,75,600	22,96,08,000	99.57
ı	Renounces	22	3.79	93,400	1,68,12,000	5.73	5,500	9,90,000	42.93
l	Total	581	100	16,31,300	29,36,34,000	100	12,81,100	23,05,98,000	100

The instructions for unblocking of funds were issued to Self-Certified Syndicate Banks ("SCSBs") and the listing applications were filed with NSE on September 19, 2025. The Dispatch of allotment advice cum unblocking intimation to the investors, as applicable, will be done after executing the corporate action for credit of Equity Shares into the respective demat accounts of the successful allottees on or about September 22, 2025. The trading in fully paid - up Equity Shares issued in the Rights Issue is expected to commence or September 23, 2025, subject to receipt of trading permissions from NSE.

DISCLAIMER CLAUSE OF NSE (THE DESIGNATED STOCK EXCHANGE): It is to be distinctly understood that the permission given by NSE should not in any way be deemed or construed that the Letter of Offer has been cleared or approved by NSE, nor does it certify the correctness or completeness of any of the contents of the Letter of Offer. Investors are advised to refer to the Letter of Offer for the full text of the "Disclaimer Clause of NSE" on page 63 of the Letter of Offer.

nvestors may contact the Registrar to the Issue in case of any query(ies)/grievance(s) including for credit of rights equity shares and /or unblocking of funds



BIGSHARE SERVICES PVT. LTD.

Office No. S6-2, 6th Floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri East, Mumbai-400 093, Maharashtra, India Contact Details: +91-022-62638200 | Fax No.: +91-022-62638299

E-mail: rightsissue@bigshareonline.com | Investor grievance e-mail: investor@bigshareonline.com Website: www.bigshareonline.com | Contact Person: Suraj Gupta SEBI Registration No.: INR000001385

THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES OR THE BUSINESS PROSPECTS OF OUR COMPANY.

For GSM Foils Limited

Pratik Mukeshbhai Makwana Company Secretary and Compliance Officer

Date: September 20, 2025

On behalf of the Board of Director